



પુનરાવર્તન - 2 (Revision - 2)

પ્ર.1

દિવસ દરમિયાન તમે જોયેલા કોઈ પણ પાંચ ફેરફારો નોંધો તથા તે ફેરફારોનું જુદા-જુદા પ્રકારમાં વર્ગીકરણ કરો.

તમે જોયેલ ફેરફાર	ફેરફારનો પ્રકાર

પ્ર.2

તમે ઉપરના પ્રશ્નમાં નોંધેલા દરેક ફેરફાર સાથે ઊર્જા કઈ રીતે સંકળાયેલી છે તેની ચર્ચા કરી નોંધ કરો.

પ્ર.3

યૂનાના નીતર્યા પાણીને રકાબીમાં લઈ એક કલાક ખુલ્લામાં મૂકો.

- એક કલાક પછી યૂનાના નીતર્યા પાણીના રંગમાં શું ફેરફાર થાય છે ?

- કેમ ?

પ્ર.4 હવાના ઘટકોના નામ લખો.

પ્ર.5 નીચે દર્શાવેલ ચિત્રોમાં બતાવેલ વસ્તુઓ કામ કરવા માટે ઊર્જાના કયા-કયા સ્ત્રોતો વાપરે છે, તેની નોંધ કરો :



પ્ર.6 નીચે દર્શાવેલ ઊર્જાસ્ત્રોતોનો ઉપયોગ કરતાં બે-બે સાધનોનાં નામ લખો :

ઊર્જાસ્ત્રોતનું નામ	તેનો ઉપયોગ કરતાં સાધનો
પેટ્રોલ	<hr/>
ડીઝલ	<hr/>
કેરોસીન	<hr/>
સીએનજી	<hr/>

ઊર્જાસ્ત્રોતનું નામ

સૌરઊર્જા

લાકડાં

કોલસા

તેનો ઉપયોગ કરતાં સાધનો

પ્ર.7

સૌરઊર્જા તથા તેના જેવા અન્ય કુદરતી ઊર્જાસ્ત્રોતોનો ઉપયોગ પેટ્રોલ, ડીઝલ કે કેરોસીન જેવા ઊર્જાસ્ત્રોતોથી ચડિયાતો છે. આ બાબત પર ચર્ચાસભા યોજી તેનાં તારણો નોંધો.

પ્ર.8

પર્યાવરણની જાળવણી માટે તમે શાળાકક્ષાએ શું પ્રયત્નો કરો છો ? તેની વિગત લખો.

